

LL.B. Semester - 3 (CBCS) Examination
Oct/Nov. -2019 [NEW COURSE]
Principles of Taxation Law & GST (Core)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન.૧ આવકવેરા અધિનિયમ - ૧૯૬૧ અનુસાર ગુનાઓની સવિસ્તાર ચર્ચા કરો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૧ ટૂંકાગાળાના અને લાંબાગાળાના મૂડી નફાને કેવી રીતે અલગ પાડશો? આવકવેરા અધિનિયમ ૧૯૬૧ હેઠળ કુલ આવકની ગણતરી સમયે આ તફાવતની શું અગત્યતા છે? તે દર્શાવો.
- પ્રશ્ન.૨ આવકવેરા ધારા હેઠળ ભાગીદારી પેઢીની નોંધણી માટેની જોગવાઈ જણાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૨ ધંધા વ્યવસાયની આવક સમજાવી મજરે મળી શકે તેવા ખર્ચાઓ ઉદાહરણ સાથે સમજાવો.
- પ્રશ્ન.૩ આવકવેરા અધિનિયમ અન્વયે સત્તાધીશો વિશે સવિસ્તાર ચર્ચા કરો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૩ આવક એટલે શું? કુલ આવકમાં કઈ - કઈ આવકોનો સમાવેશ થાય છે? ચર્ચા કરો.
- પ્રશ્ન.૪ ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ એટલે શું? જી.એસ.ટી. માટે બંધારણીય જોગવાઈઓ સમજાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૪ જી.એસ.ટી. રજીસ્ટ્રેશન અંગે સવિસ્તાર સમજાવો.
- પ્રશ્ન.૫ સમજાવો(કોઈ પણ બે) (૧૪)
 (1) ઇ-વે બીલ
 (2) ઉચ્ચક વેરો
 (3) મકાન મિલકત આવક
 (4) આવકવેરાના દર

ENGLISH VERSION

- Q.1 Discuss in detail the offences under the Income Tax Act-1961. (14)
OR
- Q.1 How do you distinguish between “short term capital gain and long term capital gain”? Indicate the importance of the distinction in the computation of the total income under the Income Tax Act 1961.
- Q.2 Explain the provisions for the Registration of the partnership firm under the Income Tax – Act. (14)
OR
- Q.2 Discuss giving examples of expenses with which are allowed under the head of business income.
- Q.3 Discuss the Income Tax Authorities in detail. (14)
OR
- Q.3 What is “Income”? Which incomes are included while computation of income?
- Q.4 What is “Goods and service Tax”? Discuss in detail constitutional provisions for G.S.T. (14)
OR
- Q.4 Explain in detail the registration of the G.S.T.
- Q.5 Explain : (Any two) (14)
 (1) E-way -Bill.
 (2) Composition of Tax.
 (3) Income of house - property.
 (4) Rate of Income - Tax.
